

Telephone conversation between External Affairs Minister and State Councilor & Foreign Minister of China, H.E. Mr. Wang Yi

April 30, 2021

વલ્લિશ મંત્રી તથા ચીનના સ્ટેટ કાઉન્સલર અને વલ્લિશમંત્રી મહામહમિ વાંગ યી વચ્ચે ટેલફોન વાતચીત

એપ્રિલ 30, 2021

વલ્લિશ મંત્રીએ આજે સાંજે ચીનના સ્ટેટ કાઉન્સલર અને વલ્લિશ મંત્રી મહામહમિ વાંગ યી સાથે ફોન પર ચર્ચા કરી હતી. અત્યારની સ્થિતિમાં ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને ટેકો આપવા માટે ચીન તરફથી કરાયેલી વિનંતીના અનુસંધાને આ કોલની વ્યવસ્થા કરાઈ હતી.

વલ્લિશ મંત્રીએ ચીનના વલ્લિશ મંત્રી વાંગ યીનો તેમણે વ્યક્ત કરેલી સંવેદના બદલ આભાર માન્યો હતો. તેમણે ભારતમાં કોવિડ-19 રોગચાળાની બીજી લહેરના કારણે સર્જાયેલા પડકારનો સામનો કરવા માટે હાલના પ્રયાસો વિશે તેમને માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ પડકારને પહોંચી વળવા માટે તમામ આવશ્યક પગલાં લેવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વલ્લિશ મંત્રીએ આ સંદર્ભમાં જાણાવ્યું કે ભારતીય સંસ્થાઓ ચીન પાસેથી વાણિજ્યિક રીતે આવશ્યક ઉત્પાદનો અને કાચી સામગ્રી મેળવવાની પ્રક્રિયા કરી રહી છે. મંત્રીએ જાણાવ્યું કે વિવિધ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને કાર્ગો ફ્લાઈટ ખુલ્લી રાખવામાં આવે અને આવશ્યક લોજિસ્ટિક સપોર્ટ ઝડપથી આપવામાં આવે તો આ પ્રક્રિયા વધુ ઝડપથી થઈ શકશે. મંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો કે કોવિડ-19 રોગચાળા જેવા ગંભીર પડકારો, જેણે તમામ દેશોને અસર કરી છે, તેના માટે વધારે ગંભીર આંતરરાષ્ટ્રીય સહકારની જરૂર છે.

વલ્લિશ મંત્રી વાંગ યીએ કોવિડ-19ને માનવજાતના દુશ્મનરૂપ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સુવ્યવસ્થિત પ્રતિભાવ આપવા માટે સંકલનની જરૂર છે. તેમણે કહ્યું કે ચીન ભારત સરકારના પ્રયાસોને ટેકો આપે છે અને કોઈ પણ વિલંબ વગર ભારતીય સંસ્થાઓને તમામ આવશ્યક સામગ્રી પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરશે. ચીનની કંપનીઓને આવશ્યક સામગ્રી ડિલિવર કરવા માટે પ્રોત્સાહિત કરાશે અને તેમને ટેકો અપાશે. એરપોર્ટ્સ, કસ્ટમ્સ અને એરલાઈન્સને સૂચના આપવામાં આવશે જેથી માલસામાન વધુ સરળતાથી પહોંચાડી શકાય. ભારતમાંથી આવતી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ આવકાર્ય છે અને ભારતે ઉઠાવેલા મુદ્દાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. વલ્લિશ મંત્રી વાંગ યી એ ચાઈનીઝ સરકાર તરફથી બીજી યોગ્ય સહાયતા કરવાની પણ ઓફર કરી હતી.

બંને મંત્રીઓએ પૂર્વ લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ઘર્ષણના તમામ બિંદુઓ પરથી પાછા હટી જવાના વાણઉકેલાયેલા મુદ્દે પણ ચર્ચા કરી હતી. વલ્લિશ મંત્રીએ જાણાવ્યું કે ત્યાંથી પાછા ખસવાની પ્રક્રિયા ચાલુ વર્ષમાં શરૂ થઈ છે,

પરંતુ હજુ પૂર્ણ નથી થઈ. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. સરહદી વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ જળવાશે તો દ્વિવપક્ષીય સંબંધોમાં પ્રગતિ આવશે. બંને મંત્રીઓ આ અંગે સત્તાવાર સ્તરે આગળ ચર્ચા કરવા સહમત થયા હતા.

ટેલિફોનના અંતે વિદેશ મંત્રીઓની બ્રિકસ અને આરઆઈસી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી જે ભારતના અધ્યક્ષપદ હેઠળ નજીકના ભવિષ્યમાં યોજાવાની છે. વિદેશ મંત્રી વાંગ યીએ આ કાર્યક્રમોમાં તેમની હિસ્સેદારીની પુષ્ટિ કરી હતી.

નવી દલ્હી

એપ્રિલ 30, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.